


॥ तस्य वाचकः प्रणवः ॥

ଲତଭରା

ଆତମନୋ ହିତାଯ ଜ୍ଗାତଃ ସୁଖାଯ —

ॐ



‘योग’ लिक्षा लावीओ, ‘लिक्षु’ बନୀ ଗୁରୁଦାର;
ମୁମୁକ୍ଷୁ ଝର ପାମଶେ, ସୌନ୍ଦ୍ର ମୁଜମାଂ ଭାଗ।

ભાવના વિનાનો કર્મકાંડ વાંઝિયો રહે છે

ગ્રાહક કહે : એક જન સોપારી આપજો ને.

હુકાનદારે સરસ મજાની વીજાવીશીને સોપારીઓ આપી. ગ્રાહક એ સોપારીઓ જોઈને કહે : “આવી નહીં, પૂજા માટેની સાવ નાની નાની આપો.”

હુકાનદાર કહે : “પુરુષોત્તમ માસ છે અને ભગવાનની પૂજા માટે લઈ જાઓ છો તો સારી સોપારી જ લઈ જાઓને!”

ઉપરોક્ત સંવાદ, મનુષ્યની ધનની અને સમજણની કંજૂસાઈનો ઘ્યાલ આપે છે.

લગ્નમાં લાખ-અડ્ધો લાખનો ખર્ચ કરવા મનુષ્ય તૈયાર થાય છે પરંતુ ભગવાન માટેની કે બ્રાહ્મણ માટેની સોપારી તો ફરી દેવી પડે તેવી જ પસંદ કરે છે. અને થાપન માટેનું વજી પજી મસોતામાંય કામ ના આવે એવું લાવે છે!

ભગવાન નિમિત્તે ચીજવસ્તુઓ સાવ કયરાપડી લાવવાની અને બદલામાં ધણી મોટી અને ઉમદા વસ્તુઓની આશાઓ રાખવાની! ભગવાનને આપતી વખતે સમજે છે કે ભગવાન તો લોઢાના કે લાકડાના છે, તેઓ ક્યાં ખાવાના કે પહેરવાના હતા? પજી જ્યારે તે પોતાની મોટી મોટી માગણીઓને પૂરી કરવા ભગવાનને માયના કરે છે ત્યારે ભગવાન લોઢાના કે લાકડાના છે તે વાત સાવ વિસારી દે છે! આ તેની સમજનું દેવાળું જ નીકળી ગયું કહેવાય ને? આવા વર્તનથી ભગવાન પજી વિચારે જ ને કે મને કાંઈ આપવું હોય છે ત્યારે હું તેને મરેલો લાગું છું તો પછી તે મારી પાસે કાંઈ મારે ત્યારે શા માટે જીવતા થવું પડે?

આ વાતને એક દાયાંતથી ખૂબ સારી રીતે સમજીએ —

એક ભાઈ હનુમાનજીના દર્શનની આશાએ હનુમાનજીની મૂર્તિની ઘણા વર્ષોથી પૂજા કરે. તો ય સફળ ના થયા એટલે એમજો હનુમાનજીની મૂર્તિ પાસે ગજાપતિની મૂર્તિ મૂકી અને તેની પૂજા શરૂ કરી. એક દિવસ તે ભાઈ ગજાપતિ માટે સારામાં સારી અગરબત્તી ખરીદી લાગ્યા. ગજાપતિની મૂર્તિ પાસે મોંઢી અગરબત્તી પેટાવવાની તૈયારી કરે છે ત્યાં તેમનું થાન હનુમાનજીની મૂર્તિ તરફ ગયું. તેથી તેઓ વિચારવા લાગ્યા કે “ઘણાં વર્ષો સુધી મેં હનુમાનજીની પૂજા કરી તો ય તેઓએ મને દર્શન ના આપ્યા, તો હવે આ મોંઢી અગરબત્તીની સુગંધ એમને કેમ માણવા દઈ? ગજાપતિ પાસે અગરબત્તી પેટાવું તો તેની સુગંધ હનુમાનનેય મળેને?” તેથી તેણે ઊભા થઈને હનુમાનજીની મૂર્તિના નાકમાં રૂનાં પૂમડાં ખોસવા માંજાં. એક ફોયશામાં રૂ ખોસીને બીજામાં ખોસવા જાય છે ત્યાં હનુમાનજી તેનો હાથ પકડી રાખીને બોલ્યા કે —

“હં... હં... મારું નાક બંધ કરીને મને શું મારી નાખવો છે? ભગત તો આ સાંભળીને દિગ્મૂઢ થઈ ગયા. થોડી કણ વળી એટલે કહેવા લાગ્યા — “કેટલાં વર્ષ સુધી મને દેરાન કર્યો છે! હવે તમને સુગંધ શાની આવવા દઈ?” હનુમાને જવાબમાં કહ્યું કે “ભાઈ! આજ સુધી તો તું મને પથ્થરની મૂર્તિ જ સમજતો હતો! આજે તેને બીક લાગી કે રખેને, મને સુગંધ આવી જશે તો! તેથી મારા નાકમાં પૂમડાં ખોસવા લાગ્યો. આથી આજે મને ખાતરી થઈ કે તું આજે મને ચૈતન્ય-જીવતો સમજે છે. એટલે મેં તુરત તારું બાવહું પકડજું અને તારી સાથે વાત કરી.”

ઉપરના દાયાંતથી ભાવનાની કેટલી કિમત છે તેનો ઘ્યાલ આવ્યો. ભાવના વિનાનો કિયાકાંડ વેઠ સમાન છે અને તેથી તે વાંઝિયો છે.

ગુજરાતમભરા

(ગુજરાતમભરા એટલે અનુભવયુક્ત સત્યથી ભરેલું)

(બહુજનહિતાય - બહુજનસુખાય)

વર્ષ - ૨૪ (જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર)

VOL - XXIV 2007-2008

સંકલન : સદગુરુસમર્પણબિલ્કુ

ISSUE - 1

માનદ તંત્રી - નૈપદ્ય વ્યાસ

પાતંજલ યોગદર્શન - સમાધિપાઠ

("મુક્તા" પુસ્તકમાંથી સાભાર)

- યોગબિલ્કુ

પતંજલિ મુનિએ યોગદર્શનના સમાધિપાઠમાં કહું કે ચિત્તવૃત્તિઓના નિરોધને યોગ કરે છે. જિજ્ઞાસુના મનમાં પ્રશ્ન એ ઉઠે કે યોગ તો પ્રાપ્ત કરવો છે પણ તેમાં અડયાર છે ચિત્તવૃત્તિઓની, તો ચિત્તવૃત્તિઓ કઈ? પતંજલિ મુનિ જ્ઞાને છે કે પાપ અને પુષ્યના ભેદવાળી વૃત્તિઓ પાંચ પ્રકારની છે; તેમનાં નામો છે પ્રમાણવૃત્તિ, વિપર્યયવૃત્તિ, વિકલ્પવૃત્તિ, નિદ્રાવૃત્તિ અને સ્મૃતિવૃત્તિ. જિજ્ઞાસુ વૃત્તિઓને સમજે છે એટલે તેના મનમાં બીજો પ્રશ્ન ઉઠે છે કે આ પાંચેય વૃત્તિઓનો નિરોધ કઈ રીતે કરવો? પતંજલિ મુનિ જ્ઞાને છે કે અભ્યાસ અને વૈરાગ્યથી વૃત્તિઓનો નિરોધ થાય છે. વળી અભ્યાસ અને વૈરાગ્ય વિધે સમજીવતાં કહે છે કે વૃત્તિરહિત થવાની સ્થિતિ માટે જે પ્રયત્ન કરવો તે અભ્યાસ કહેવાય છે. લાંબા સમય સુધી, અખાયપણે અને આદરપૂર્વક પાલન કરવાથી અભ્યાસ પરિપક્વ થાય છે. ભોગવેલા અને સાંભળેલા વિષયોમાંથી તૃષ્ણારહિત થઈ જવું - વિષયો ઉપર કાબૂ કરી લેવો તેનું નામ વૈરાગ્ય છે. વિષયોમાંથી તૃષ્ણારહિત કેવી રીતે થાય? પરમ પુરુષના - જુલાઈ-૨૦૦૭

ઈશ્વરના, ગુરુના ગુણાનુવાદ કરવાથી તૃષ્ણારહિત થવાય છે.

દહે સંપ્રશાત સમાધિ કોને કહેવાય તે કહે છે.
વિતર્કવિચારાનંદાસિતાનુગમાત્ સંપ્રશાત: ॥ ૧૭ ॥

ભાવાર્થ : વિતર્ક, વિચાર, આનંદ અને અસ્મિતાયુક્ત એકાગ્રતાને સંપ્રશાત સમાધિ કહે છે.

વિસ્તાર : તૃષ્ણારહિતપણું પ્રાપ્ત કરી લીધા પછી કેવી પોત્યતા પ્રાપ્ત થાય છે? ચિત્ત કેવો અધિકાર મેળવી લે છે? કેવા અભ્યાસો માટે તે લાયક બને છે? હવે ચિત્ત સમાધિના અભ્યાસ માટે લાયક બને છે.

વિતર્ક, વિચાર, આનંદ અને અસ્મિતામય થઈને જે એકાગ્રતા પ્રાપ્ત થાય છે તેનું નામ સંપ્રશાત સમાધિ છે.

"સંપ્રશાત" માં સં, પ્ર અને શાત એવા ત્રણ શબ્દો છે. સં અને પ્ર એ બે અધિકતા-બીજોક પ્રત્યય છે. શાત એટલે જ્ઞાનવું. સં એટલે સારી રીતે અને પ્ર એટલે અધિક, તેથી સંપ્રશાત શબ્દનો અર્થ થયો ખૂબ સારી રીતે જ્ઞાનવું. સંપ્રશાત એટલે ધ્યેયના - વસ્તુ-પદાર્થના સ્વરૂપને ખૂબ ઊડાજાથી અને સચોટપણે શાત કરી લેવું, જાણી લેવું, તેના સ્વરૂપનું જાન પ્રાપ્ત કરી લેવું. હવે સમાધિઓના પ્રકારની વાત

આવી રહી છે. હવે સમાપ્તિઓના પ્રકારની વાત એટલા માટે આવી રહી છે કે ચિત્ત હવે સમાપ્તિને લાયક થયું છે. આગળ કહેલી સાફનાઓમાંથી તે પસાર થયું. તે બધામાંથી જે ઉસ્તગત થયું તેથી ચિત્તમાં તેવો અપિકાર આવ્યો? એકજી થઈ શકે એવો, ગાડ એકાગ્રતાનો અભ્યાસ કરી શકે એવો, સમાપ્તિનો અનુભવ લઈ શકે એવો, આ એકાગ્રતાને ચાર પ્રકારમાં વિભક્ત કરી નાખી છે. ચિત્ત વિતર્કમય ચ્યાથી જે એકાગ્રતા પ્રાપ્ત થાય તે વિતર્કસમાપ્તિ, ચિત્ત વિચારમય ચ્યાથી જે એકાગ્રતા પ્રાપ્ત થાય છે તે વિચારસમાપ્તિ, ચિત્ત આનંદમય ચ્યાથી જે એકાગ્રતા પ્રાપ્ત થાય છે તે આનંદસમાપ્તિ અને ચિત્ત અસ્મિતામય ચ્યાથી જે એકાગ્રતા પ્રાપ્ત થાય તે અસ્મિતા નામની સમાપ્તિ કહેવાય છે. હવે તે ચારેયને વધુ સમજુંબે.

વિતર્ક, વિચાર, આનંદ અને અસ્મિતા એટલે શું? વિતર્ક એટલે વિશેષ તર્ક. અને વિશેષ તર્ક એટલે શું? કોઈ સ્થૂળ પદાર્થ ઉપર વિશેષ તર્ક કરીને તેના મૂળ તત્ત્વ સુધી પહોંચી જવાનો પ્રયત્ન કરવો, વિશેષ તર્ક દ્વારા જે કાંઈ જાસ્તવામાં આવે તેનું પણ કરાશ જાણીને જેનું કરશું ના હોય ત્યાં સુધી પહોંચી જવું; કાર્યનું કરશું ગોત્તાં ગોત્તાં તેની મૂળ સ્વિતિ સુધી પહોંચી જઈને લગભગ નિરોધાવસ્થા પ્રાપ્ત કરી દેવી. એકાગ્રતાથી જે મૂળ સુધી પહોંચી શકાય. નહીં તો મન અનેકાગ્ર છે, અનંતાગ્ર છે, અનેક જગ્યાએ ભર્મી રહ્યું છે. અત્યારે અમે યોગદર્શનની કથા કરી રહ્યા છીએ ત્યારે મુખ્યપણે અમારું ધ્યાન-મન યોગદર્શનની કથામાં છે, પણ ગૌણપણે બીજે ધર્મે બધે ભર્મી રહ્યું છે. જો આ કથા કરતાં કરતાં અમારું મન પ્રધાનપણે બીજે ભર્મવા લાગે તો કથા બરાબર થઈ શકે નહીં, કથામાં ગૌણતા આવી જાય. એ જે પ્રમાણે તમે કથા સાંભળી રહ્યા છો, કથા

સાંભળતી વખતે તમારું મન-ચિત્ત કથા સાંભળવામાં મુખ્યપણે એકાગ્ર છે અને ગૌણપણે બીજે પણ ભટકી રહ્યું છે. જે ધરીએ તમારું ચિત્ત કથા સાંભળવામાં અપ્રધાનપણે રહે અને પ્રધાનપણે બીજે ચાલ્યું જાપ તો તે ધરીએ ત્યાં સાંભળી ના સાંભળી થઈ જાપ. તો “દુઃખિયામે દોનોં જાપે, ના માયા મિલી ના રામ” જેવું થાપ.

એકલા શરીરથી કે એકલા મનથી કોઈ કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી. તન અને મન બંને સાથે હોવાં જોઈએ. તન અહીંયાં હોય અને મન જગતનાં બીજીં કાર્યોમાં ગયેલું હોય તો અહીં મનની ગેરહાજરી થઈ. તેથી એકલા તનથી કથાશ્રવણ બરાબર કરી શકાય નહીં. અને બરાબર જે શ્રવણ ન કરી શકાય તે બરાબર સમજી તો શકાય જ કથાંથી? બરાબર સમજવા માટે ધ્યાનપૂર્વક શ્રવણની જરૂર છે. ધ્યાનપૂર્વક શ્રવણ કરી શકીએ તે માટે તન અને મન બંનેની હાજરી હોવી જોઈએ. તન અહીંયાં હોય અને મન મિલમાં, ઘોંસિસમાં કે દુકાનમાં હોય તો તન અહીં એકલું રહ્યું. મન અહીં હાજર નથી. તેથી મન વિના તન એકલું કથાને સારી રીતે સાંભળી શકે નહીં અને મન દુકાનમાં ગયું તો તે એકલું ત્યાં કંઈ કામ કરી શકે નહીં. દુકાનનું કાર્ય કરવું હોય તો ત્યાં તન અને મન બંનેની હાજરી હોવી જોઈએ. મન એકલું ત્યાં છે અને તન એકલું અહીં છે તેથી ના તો તન એકલું અહીં કામ કરી શકે કે ના તો મન એકલું ત્યાં કામ કરી શકે. તેથી કહ્યું છે કે દુઃખિયામે દોનોં જાપે, ના માયા મિલી ના રામ. બંને જુદાં રહેવાથી ના તો માયા મળી કે ના તો રામ મળ્યા; ના તો વ્યવહારિક કામ કરી શક્યા કે ના તો પરમાર્થનું કામ આણોપી શક્યા. માટે વ્યવહારમાં જ્યારે લાગીએ ત્યારે તન અને મન બરાબર વ્યવહારમાં લગાવી દઈએ અને જ્યારે પરમાર્થમાં, પારમાર્થિક

કથા-વાતી ઈત્યાદિમાં બેસીએ ત્યારે તન-મનને સંપૂર્ણપણે રેમાં લગાડી દઈએ જેથી કાર્ય સંપૂર્ણ થાય.

વિતકની વાત ચાલતી હતી. વિતક એટલે વિરોધ તર્ક, તેને ઘડાના દ્રષ્ટાંતરી સમજાયે. માટીના ઘડા પર તર્ક-વિતક કરવા લાગ્યા. ઘડો રૂડો-રૂપાળો અનેક રંગોથી રંગેલો છે, તેના ઉપર અનેક ચિત્રો છે. તેવા ઘડાનું કારણ શું? તો વિતક કરતાં સમજાય કે ઘડાનું કારણ માટી છે. વિતક આગળ ચાલે અને માટીના કારણ અણુઓને જાણો, અણુઓનું સંગઠન-સંપટન એનું નામ જ માટી. અણુઓનું કારણ પરમાણુ. અનેક પરમાણુઓ ભેગા થવાથી એક અણુ બન્યો. અનેક અણુઓ ભેગા થયા તેની માટી બની અને માટીને વ્યવસ્થિત કરવામાં આવી ત્યારે તેનાં ઘડો, મૂર્તિ, ઠિઠો કે નાણિયાં વગેરે બન્યાં. આમ અનેક ઘાટ, રૂપ, રંગ બન્યાં. પણ અનેક રૂપ-રંગ તે બધાનું મૂળ કારણ પરમાણુ છે. સમસ્ત સ્થૂળ જગત જે વિવિધ રૂપો-રંગો ભાસી રહ્યું છે તે પરમાણુઓનું જ વિસ્તરણ છે. આમ ઘડાથી શરૂ કરી તેના મૂળ કારણ પરમાણુ સુધી પહોંચી જવું તે થઈ વિતક નામની સમાપ્તિ.

બીજુ આવી વિચારસમાપ્તિ. જે રીતે ઘડા ઉપર વિતક ડખો હતો તે જ પ્રમાણે આમાં પણ વિતક જ કરવાનો છે પરંતુ તેના માટેનો શબ્દ બદલાયો અને 'વિચાર' થયો. આને વિચાર શા માટે કહેવામાં આવ્યો? કારણ કે વિતકમાં ઘડો 'સ્થૂળ' પદાર્થ હતો અને વિચારમાં 'સૂક્મ' પદાર્થ લેવાનો છે. સ્થૂળના બદલે સૂક્મ પદાર્થ ઉપર વિતક કરવામાં આવે એટલે તેનું નામ વિચાર થઈ ગયું. તેને શરીરના દ્રષ્ટાંતરી સમજાયે.

જેમ ઘડાનું મૂળ કારણ ગોતી કાઢવું તેમ શરીરનું મૂળ કારણ પણ ગોતી કાઢીએ. શરીરરૂપી ઘડાનું મૂળ કારણ શું? શરીર શાનું બનેલું છે? તે

માંસ, મેદ, મજજુ, અસ્થિ વગેરે સાત પાતુઓનું બનેલું છે. પછી બીજા અંદરના સૂક્મ પદાર્થો જોઈએ. એમ એક એક કાર્ય અને તે કાર્યનું કારણ સમજતા જઈએ. પછી કારણનું કારણ અને તેનું પણ કારણ ગોતીએ. છેલ્લે માતા-પિતા દારા શરીરની ઉત્પત્તિ, માતાપિતામાં રહેલા ૨૪-વીઠ જામના તત્ત્વમાંથી શરીરનું ઉત્પત્ત થવું, વિકાસ પામવું વગેરે જાણીને શરીરનું કારણ પણ ગોતી કાઢવું. આનું નામ વિચારસમાપ્તિ, અર્થાત્ વિચાર દારા એકાગ્રતા પ્રાપ્ત કરવી.

ત્રીજી છે આનંદસમાપ્તિ નામની એકાગ્રતા. આનંદની સ્વિતિમાં આનંદમય થઈને એકાગ્ર થઈ ગયા.

એક ઉપર અગ્રતા તેનું નામ એકાગ્ર અને અનંત જગ્યાએ મન બટકતું-રખતું હોય તે અનંતાગ્ર. બધામાં મન થોડું થોડું લાગેલું હોય તેથી કોઈ પણ વાતનો નિકાલ ના લાવી શકે. લાંબા સમય સુધી ધ્યાનનો અભ્યાસ કરવાથી તે 'અનંતાગ્ર'માંથી 'અમૃકાગ્ર' થાય. લાખ જગ્યાએ બટકતું હોય તેમાંથી હજાર જગ્યાએ અને હજારમાંથી સો જગ્યાએ અને સોમાંથી દશ જગ્યાએ આવે અને છેલ્લે એક જગ્યાએ એકાગ્ર થઈ જાય. જગ્યારે મન એકાગ્ર થાય લારે તે જેના ઉપર એકાગ્ર થયું હોય તેનું રહસ્ય પામીને સમાપ્તાન મેળવી લે છે. સમાપ્તાન મળી જાય પછી ચિત્તને તે તરફ જવાનું જ મટી જાય, તે તરફની તેની કુતૂહલ અને જિશાસાવૃત્તિ જ ટળી જાય. કારણ કે એવો સમાપ્તાન પ્રાપ્ત કરી લીધું છે. સ્થૂળ કે સૂક્મ જે કાંઈ હતું તેમાંથી ચિત્તે સમાપ્તાન પ્રાપ્ત કરી લીધું. જવાં સુધી અસમાપ્તાન છે ત્યાં સુધી જ બધી દોડાદોરી છે ને! તો, આ રીતે ચિત્તે સ્થૂળ અને સૂક્મમાંથી સમાપ્તાન મેળવી લીધું તેથી હવે એવા નિર્ણય ઉપર આવાયું કે સ્થૂળ પદાર્થ ઘડો અને સૂક્મ પદાર્થ શરીર તે હું નહીં.

શરીરે હું નહીં અને ઘડોપ હું નહીં કે જે સૂક્મ જગતના સૂક્મ પદાર્થો અને સ્થૂળ જગતના સ્થૂળ પદાર્થો છે. જગતમાં બીજું છે પણ શું? સૂક્મ અને સ્થૂળ એ બેદી જગત બનેલું છે તેથી શરીર અને ઘડાના માધ્યમથી આખા જગતની જ્ઞાનકારી પ્રાપ્ત થઈ ગઈ. જગત હું નહીં, હું તો જગતથી જુદો. જે સ્થૂળ અને સૂક્મ છે તે પણ હું નહીં એવી સાચી વાતની ખબર પડી ત્યારે આનંદની ઉર્ભિનો ઉભરો ચડ્યો - ખૂબ આનંદ થયો અને આનંદમાં મસ્ત થઈને એકાગ્ર થઈ ગયા; સમાવિ લાગી ગઈ.

વ્યાવહારિક બાબતોમાં પણ ઘણાં વર્ષો સુખી ભ્રમણામાં હોઈએ છીએ અને જે દિવસે ખબર પડે કે આટલાં વર્ષોથી હું જે કાઈ માનતો હતો, હડીકતમાં તો તેથી કાઈક જુદું છે ત્યારે કેટલો આનંદ થાય છે! ત્યારે આ તો મનુષ્યજન્મ સાર્થક કરવાની સાચી વાતની ખબર પડી, ભ્રમણામાંથી મુક્ત થયા. સ્થૂળ અને સૂક્મ હું નથી તો તેની સાથે મારે શી લેવાઈવા? સ્થૂળ અને સૂક્મ રહે તોપણ મારે શું, નાચ થઈ જાય તોપણ મારે શું અને પરિવર્તન પામતુ રહે તોપણ મારે શું?

‘હું’ અને ‘મારું’ એ તો કાઈ જુદું જ છે. સ્થૂળ અને સૂક્મના આદાનપદાનથી કે તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિથી જબરજસ્ત આધાતો લાગતા હતા, ખૂબ અને સુખ ઉત્પસ થતાં હતાં તે ચાલ્યાં ગયાં. તે કારણે સતત આનંદ થવા લાગ્યો. કેમ કે શોક આપનાર જે કારણ હતું તે ચાલ્યું ગયું; સ્થૂળ અને સૂક્મ ઉપર ‘મારો અધિકાર’, ‘મારાપણું’ હતું તે ચાલ્યું ગયું. આ થઈ આનંદસમાપ્તિ.

વિતકી, વિચાર, આનંદ અને અસ્મિતા; આ ચાર પ્રકારની એકાગ્રતાઓ એટલે કે સમાપ્તિઓ-સમાપ્તિઓ છે. તેને સમાપ્તિ પણ કહી છે અને સમાવિ પણ કહી છે. પણ તે બનેનો અર્થ છે એકાગ્રતા. આપણું મન-ચિત અનેકાગ્ર છે, અનંતાગ્ર

છે; તેમાંથી થીમે થીમે ખારણા, ધ્યાન અને સમાપ્તિના અભ્યાસ દ્વારા તેને એકાગ્રતા તરફ વાળવાનું છે. એ સિવાય પણ શુશ્મજનો દ્વારા આપણાને જે કાઈ પણ સાખન કે સાખના મળેલાં હોય; જ્યે, તથી ઈત્યાદિ અથવા તો જે કાઈ લીડિક કાર્ય પણ આપણાને સૌંપવામાં આવેલું હોય તે બધાને સંપત્ત કરવાથી પણ એકાગ્રતા પ્રાપ્ત થઈ શકે છે. અસ્તુ.

એકાગ્રતાની પૂર્તિ

અહીં એકાગ્રતાનું પ્રકરણ ચાલી રહ્યું છે ત્યારે તેના વિષેનો થોડો વિસ્તાર ઉપયોગી નીવડશે.

અવારનવાર સાખડો એવી ફરિયાદ, એવા પ્રશ્નો કરતા હોય છે કે -

પ્રશ્ન : અમે ધ્યાનમાં બેસીએ છીએ ત્યારે તો વૃત્તિઓ ખૂબ ભાગદોડ કરે છે, એટલી ભાગદોડ તો ધ્યાનમાં નથી બેઠા હોતા ત્યારે પણ નથી કરતી. આમ કેમ બનતું હશે?

ઉત્તર : ધ્યાન વખતે તમને વૃત્તિઓની જે વધુ ભાગંભાગી, વધુ ચંચળતા લાગે છે તે જ ધ્યાનમાં થોડા સહા (થોડા ધ્યાનસ્થ) થયાની સાભિતી છે. જ્યારે ધ્યાનમાં બેઠા નહીંતા ત્યારે મન અનંતાગ્ર હતું. એ વખતે મનની ચંચળતા એટલી અધિક હતી કે નોંધ લઈ જ ના શકાય. પણ ધ્યાનમાં બેઠા ત્યારે મન અમુકાગ્ર થયું, તેની અનંતાગ્રતા ટળી. જેથી આપણે તેની નોંધ લઈ શકીએ એટલી જ તેની ચંચળતા-ભાગંભાગી રહી. મનની ભાગંભાગીની ગણતરી કરી શકીએ એટલી જ તેની ચંચળતા રહી તે જોઈ આપણે કહ્યું કે - આપણને લાગ્યું કે “અન્ય સમય કરતાં જ્યારે ધ્યાનમાં બેસીએ છીએ ત્યારે વધુ ચંચળ થઈ જવાય છે.” હડીકતમાં તો તે વખતે વધુ ચંચળતા નહોતી પરંતુ તે વખતે મન અનંતાગ્રતા છોડીને અમુકાગ્ર થયું તેથી તે ચંચળતાની આપણે નોંધ રાખી શક્યા, અને તેથી લાગ્યું કે મન ધ્યાન

વખતે બહુ ચંચળ થઈ જાય છે. જેમ ભમરડો અતિશય ગતિમાં કરતો હોય છે ત્યારે તે ગતિમય નથી લાગતો, તેની ગતિ મધ્યમ થાય છે ત્યારે જ તે ગતિશીલ જાગ્રાય છે. તેમ, જયારે આપણે સામાન્ય હિન્દુચર્ચાની પ્રવૃત્તિઓમાં હોઈએ છીએ ત્યારે મન એટલું બહું ચંચળ હોય છે કે જેની નોંધ લઈ જ ના શકાય. પણ ધ્યાન વખતે તેની ચંચળતા થોડી થટે છે તેથી આપણે તે ચંચળતાની નોંધ લઈ શકીએ છીએ, અને તેથી આપણને એમ લાગે છે કે “ધ્યાન વખતે મન બહુ ભાગભાગી કરે છે.”

માટે ધ્યાન કરનારાએ નિરાશ ન થવું. (ઉપરોક્ત મુલાસો પાદ રાખીને ઉત્સાહમાં રહેવું. (એકાગ્રતાની પૂર્તિ સમાપ્ત)

ચોથી આવે છે અસ્મિતા સમાપ્તિ. એમાં નથી તો વિતર્ક, કે વિચાર, કે આનંદ; પરંતુ આનંદ અવસ્થામાં આગળ વખતા વખતા કેવળ ‘અસ્મિતા’, અર્થાતું ‘અસ્મિ-અસ્મિ’, એટલે કે હું, હું, હું; એમ કેવળ અસ્તિત્વનું જ ભાન રહેવું તેનું નામ અસ્મિતાસમાપ્તિ.

“અસ્મિ” શબ્દ મહાવાક્યમાં આવે છે. “અહું બ્રહ્માસ્મિ” એટલે કે અહું (હું) + બ્રહ્મ + અસ્મિ (હું), અર્થાતું હું બ્રહ્મ હું. આમાં જ્ઞાન પદો છે; હું, બ્રહ્મ અને હું. ‘હું બ્રહ્મ’ એમ કહેતાંની સાથે જ બે છીએ એ સાબિત થાય છે - હું અને બ્રહ્મ. હું અત્યારે બ્રહ્મ નથી ત્યારે મારે કહેવું પરંતુ હું બ્રહ્મ હું, હું, બ્રહ્મ અને હું; એમાંથી જયારે ‘હું’ નીકળી જાય ત્યારે ‘બ્રહ્મ હું’ બચી રહે. બ્રહ્મ હું એમ કહેતાંની સાથે જ એક અધ્યાહાર પડેલો છે કે બીજું કાંઈ નથી, માત્ર બ્રહ્મ હું. ‘હું’ તો નીકળી ગયો, હવે રહ્યું માત્ર ‘બ્રહ્મ હું’. પણ બ્રહ્મ હું એમ પણ કેમ કહેવું પડે છે? એવી પ્રતીતિ પણ શાના આધારે થાય છે કે બીજું કાંઈ નથી અને બ્રહ્મ હું?

જુલાઈ-૨૦૦૭

હું એ નહીં, બ્રહ્મ નહીં અને કેવળ હું, હું, હું - હાજરી, એક અસ્તિત્વ, અસ્તિત્વનો જ કેવળ અનુભવ, કેવળ અસ્તિત્વનું જ ભાન. અસ્તિત્વના ભાનમાં જ તન્મય-તન્દ્રપ. આવી અવસ્થાનું નામ આપવામાં આવ્યું અસ્મિતાસમાપ્તિ. અસ્મિતા એટલે અસ્મિનો ભાવ.

હું આ જગતનો કોઈ સ્થૂળ કે સૂક્મ પદાર્થ નથી તેની ખાતરી થતાં એક અલોકિક હિંય આનંદની ઉપલબ્ધિ થઈ અને તે આનંદમાં અને આનંદમાં પહોંચી જવાયું ‘અસ્મિ, અસ્મિ, અસ્મિ’ સુધી. ધીમે ધીમે તે આનંદનો પણ લોપ થઈ ગયો, આનંદ લેનાર જ કોઈ ના રહ્યું, આનંદનો અનુભવ કરનાર જ કોઈ ના બચ્યું; કેવળ અસ્તિત્વ જ રહ્યું. એનું નામ અસ્મિતા નામની સંપ્રણાત સમાપ્તિ.

હવે અસંપ્રણાત સમાપ્તિ કોને કહે છે તે સમજુએ.

વિરામપ્રત્યાભ્યાસપૂર્વ: સંસ્કારશોષોન્ય: ॥૧૮॥

ભાવાર્થ : (વૃત્તિઓને) વિરામ પમાડવાની યુક્તિનો પુન: પુન: અત્યાસ કરતાં કરતાં તેના માત્ર સંસ્કાર બચી રહે તે “અન્ય” (અર્થાતું તેને અસંપ્રણાત કહે છે).

વિસ્તાર : ચાર સમાપ્તિઓનો સમાવેશ સંપ્રણાતમાં થયો. તેનાથી જે અન્ય - જુદી છે તે ‘અસંપ્રણાત’. આ જગ્યાએ ‘અસંપ્રણાત’ શબ્દ આવતો નથી, આ સૂત્રમાં તો “અન્ય” શબ્દ છે. આગળ જે વિતર્કાર્દિ ચાર કહેવામાં આવી તે સંપ્રણાત અને હવે જે કહેવામાં આવે છે તે અન્ય, અર્થાતું, સંપ્રણાતથી જુદી-ભિન્ન, એટલે કે અસંપ્રણાત. અહીં અસંપ્રણાત નામ આપણે આપી દીધું છે. આ તો યોગની ભાષા, સૂત્રાત્મક ભાષા. એટલા બની શકે તેટલા ઓછામાં ઓછા અસરોમાં

અને શબ્દોમાં ઘણું બધું કહી નામબંદ, વપુમાં વપુ કલ્યાણકારી પોરસી દેવું તેનું નામ 'સૂત્ર'.

સૂત્ર કોને કહેવાયા? જેને ગુજરાતીમાં સૂતર કહીએ છીએ તેને સંસ્કૃતમાં સૂત્ર કહેવામાં આવે છે. સૂત્રની સીધી-સાદી અને ટૂંકી-ટચ વાખ્યા કરવી હોય તો એમ કહી શકાય કે 'ગાગરમાં સાગરને સમાવી દેયો.'

સૂત્ર એટલે સૂતર, સૂતર એટલે કપાસનો તંતુ-દોરો. અને સૂતરનો બીજો અર્થ સરળ-સીધું. કહીએ છીએ ને કે અમુક કાર્ય સમુસૂતર પાર ઊતરી ગયું.

માળામાં જે સૂતર રહેલું છે તેના આપારે જ બધા મળવા રહેલા છે. સૂતર બહે આપણને દેખાનું નથી છતો એકસો ને આઈ પારા તેના આપારે જ રહ્યા છે. સૂતર તો છુપાયેલું છે પરતુ જોમાં જ મણકાઓને તે પારણ કરી રહ્યું છે. સૂતર અતિ સૂક્ષ્મ સ્વરૂપમાં છે. રદ્રાક્ષની માળામાં એક એક મણકો મોટા બોર જેવડો હોય છે. એવા એકસો ને આઈ મણકાને લાઈનબંધ ગોઠવીએ તો કેટલી જગ્યા રોકે - કેટલું મોટું કદ થાયા! પરતુ એકસો ને આઈ મણકાઓને પારણ કરી રાખનાર સૂતર તો અતિ સૂક્ષ્મ - અતિ પાતળું હોય છે. તે ધણી ઓછી જગ્યામાં સમાઈ જાય છે. છતાંય તે બધાય મણકાઓને પારણ કરી રાખે છે, પોતે સૂક્ષ્મ હોવા છતાંય ધણા સ્થૂળ અને મોટા મણકાઓને પારણ કરી રાખે છે, સુભવસ્થિત રાખે છે અને ત્યારે જ આપણે માળાનો ઉપયોગ કરી શકીએ છીએ. પૌત્રાના ઇપનું પ્રદર્શન કર્યા સિવાય સૂતર મણકાઓને પારણ કરી રાખે છે ત્યારે જ માળાનો-મણકાઓનો સદ્ગુપ્ત્યોગ કરી શકાય છે. આનો બધો જ આભાર અને પણ એમાં છુપાયેલા સૂતરને છે.

યોગદર્શન અને બીજા દર્શનો અને શાસ્ત્રો સૂત્રોમાં ડહેવાયેલાં, ચચયિલાં, સંબોધાયેલાં છે. તે સૂત્રોમાં શા માટે છે? થોડામાં ઘણુંબધું આપણને

બેટ-પ્રસાદી-ભક્તિસરૂપે આપી દેવાનું છે તેથી. ઘણુંબધું આપી દેવા માટે જો ધરા મોટા કદનું શાખ થાય તો ક્ષારે વાંચીને સમજું શકીએ? માટે તે અખાં સૂત્રાત્મક છે.

સૂત્ર વિષે અહીં થોડું વધારે સમજવાનો પ્રયત્ન કર્યો. હવે મૂળ સૂત્રને આગળ ચલાવીએ.

અભ્યાસ કરતાં કરતાં તમામ વૃત્તિઓનો વિરામ કરી દેવાનો છે. જે વૃત્તિઓ આપણને કનાંડતી હતી, ગાસ આપતી હતી, જે આપણને સહા સામાન્ય સંસારી બનાવી રાખવી હતી તેનો અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા એવો નિરોપ થઈ જથો કે સંસ્કારમાત્ર શેષ બચ્યા. વૃત્તિઓને વિરામ પમાડી દીધા પછી, તેને વિરામ પમાડવાનું જે શાન (વૃત્તિઓને કઈ રીતે વિરામ પમાડી દેવી તેની પણ એક આંતરસૂત્ર પ્રગટે છે. આંતરસૂત્રને પણ વિરામ પામવાનું અને પમાડવાનું જે શાન) તે પણ અભ્યાસ કરતાં કરતાં કેવળ સંસ્કારરૂપે રહી જાય છે. પહેલાં વૃત્તિઓ હતી, પછી તેનો વિરામ થવા લાગ્યો. જે અનંતાગ્ર હતી તે એકાગ્ર થઈ અને પછી નિરોપ-વિરામ પામવા લાગ્યો. વિરામ કઈ રીતે પમાડવી તેનું જે શાન તે પણ અભ્યાસ કરતાં કરતાં છેવટે કેવળ સંસ્કારરૂપે રહી ગયું. વિરામ પમાડવાનું શાન પણ ઇક્ત સંસ્કારરૂપે રહી ગયું ત્યારે ચિત્તની તે ભાવનામયતાને - તે અવસ્થાને પંચાંગિ મુનિઓ નામ આપ્યું 'અન્ય'; જેને આપણે નામ આપ્યું અસ્મેમજાત.

આ રીતે સંમેશ્વાત અને અસંપ્રશ્નાત સમાપ્તિને સમજવાનો પ્રયત્ન કર્યો. આવી અસંમેશ્વાત સમાપ્તિ પ્રાપ્ત થઈ હોય એવા ભાગ્યશાળી મોશ છે? તેનો જવાબ ઓગળીસમું સૂત્ર આપે છે. આ સૂત્ર આપણે "રતમભરા" ના હવે પછીના અંકમાં સમજુશું. અસ્તુ. (કમશઃ)

ધ્યાનમાં એકાગ્રતા

- પ્રવિશોભાઈ શાહ

ધ્યાન કરવું એટલે મનને સ્થિર કરવું, મનની ગંધેલતા ઓળ્હરી કરવી, મનની એકાગ્રતા વધારવી. મન-ચિન આમ તો સતત વૃત્તિઓથી દેરાયેલું જ રહે છે. વિષયો, વિચારો, વિજ્ઞારો અને વાસનાઓમાં વિચયરતું હોય છે. મનમાં સતત સંકલ્પ-વિકલ્પ, તર્ક-વિતર્ક, ખંડન-મંડન ચાલતાં જ હોય છે. ધ્યાનમાં બેસીએ એટલે આપણા મનમાં ચાલતા વિચારનો પ્રવાહ આપણને દેખાવા લાગે, એક વિચાર આવો, થોડીક વાર સ્થિર થયો ના થયો ત્યાં બીજો વિચાર આવે. વિચારની સાથે દરથો-ઘટનાઓ અને પ્રસંગોની દારમાણા ઊભરાવો લાગે, મન એમાંથી સુખની કે દુખની અનુભવ કરે. આપણે એ બધું સાક્ષીભાવે જોયા કરવાનું, મનને રોકવાનો કે અટકાવવાનો પ્રયત્ન કરવાનો નહિ. ધ્યાનમાં બેસીએ ત્યારે માનસિક જીપ ચાલુ હોય કે માનસિક રીતે આપણા ઈષ્ટદેવ કે આપણા શ્રદ્ધેય ગુરુ-સંતનું અરદ્ધ કરતા હોઈએ તો થીમે થીમે પેલા વિચારોનું અતિકમજા ઓછું થતું જરો. માનસિક જીપ કરતા હોઈએ તો એ મંત્રના શાન્દો-અલરો - એનો અર્થ-ભાવ વળેરે મનમાં રમવા લાગે. ઈષ્ટદેવની છનિ-મૂર્તિ-આકૃતિમાં કે આપણા શ્રદ્ધેય ગુરુ-સંતનું જીવન-દર્શન કરવામાં મન લાગે અને બીજા સાંસારિક-બ્રહ્માદરના વિષયોમાંથી તે વિશ્વાસ પામે.

યોગશાસ્નમાં એકાગ્રતા કેળવવા માટે અલગ અલગ ઉપાયો સૂત્રો દરાય સૂચવવામાં આવ્યા છે. એક સૂત્ર છે ‘‘સ્વમનિદ્રાશાનાંબનનાં વા ॥’’ ભાવાર્થ: અથવા તો સ્વમ અને નિદ્રાના જીબનનું આલંબન દેવાથી (એકાગ્રતા પ્રાપ્ત થઈ શકે છે.)

આપણે જવારે જાગૃત અવસ્થામાં હોઈએ છીએ ત્યારે આપણી સ્થૂળ ઈન્દ્રિયો જગતના સ્થૂળ

વિપ્યાને બ્રહ્મણ કરે છે. દાંત, આંખ જેવાનું કામ કરે છે. કાન સાંભળવાનું, નાક સુંધરવાનું અને છલ સ્વાદ દેવાનું કામ કરે છે. પરંતુ આપણે જવારે સૂઈ જઈએ છીએ ત્યારે ગાંઠ નિદ્રા આવે તે પહેલાં ઉધમાં સ્વમ-અવસ્થા ચાલતી હોય છે. આ સ્વમ અવસ્થામાં આપણી સ્થૂળ ઈન્દ્રિયો તો આરામમાં હોય છે પણ મન એકલું જ કાર્યરૂપ હોય છે. મનમાં વિચારો ચાલતા હોય છે અને એ વિચારો પ્રમાણે આપણી બધું આંખો સમન્ન અલગ અલગ દર્શયો દેખાય છે. સ્થૂળ ઈન્દ્રિયોની દાજીરી નથી છતાં પણ આપણા મનમાં જે વિચારો ચાલતા હોય છે તે પ્રમાણેના દરથો સર્જીય છે. આપણી ગજાગૃત અવસ્થામાં મન જો અમૃત વિચાર કરે તો તે પ્રમાણેનું દરથ્ય સ્વમમાં દેખાય છે. તો જો જગૃત મન કોઈક સંકલ્પ કરે અને તે વખતે ઈન્દ્રિયોની દાજીરી ના હોય તો તે સંકલ્પ પ્રમાણેનું દરથ્ય સર્જી શકાય.

તો હવે જવારે આપણે ધ્યાનમાં બેસીએ ત્યારે એક ધેય લઈને બેસીએ - મનમાં એક સંકલ્પ લઈને બેસીએ કે ધ્યાનમાં આપણા ઈષ્ટદેવની છનિ - આપણા ગુરુસંતનું દર્શન કે કોઈ એક મંત્રના શાન્દો-અલરો-ભાવ દેખાય, સંભળાય, અનુભવાય. પાંચેય કર્મનિદ્રિયોને તેના વિષયમાંથી પાછી ચાળી લઈને અંતમુખ થઈ જઈએ. આ રીતે સ્વપ્રાવસ્થા વખતે મન અને ઈન્દ્રિયોની જે સ્થિતિ હોય છે તેવી સ્થિતિ તેવો ભાવ મનમાં રાખીને ધ્યાનમાં બેસીએ તો સારી એવી એકાગ્રતા આવે, મન અમૃત ચોક્કસ જગ્યાએ સ્થિર થાય. આને કહેવાય સ્વમના જીબનનું આલંબન.

નિદ્રાવસ્થા દરમ્યાન મન અને ઈન્દ્રિયોની જે સ્થિતિ હોય છે તેવી સ્થિતિમાં મનને લઈ જઈને તેને

એકાગ્ર કરવાનો પ્રયત્ન કરીએ તો તે “નિદ્રાશાનાલંબનં” થયું કહેવાય. આપણો જીવીએ છીએ કે ગાડ નિદ્રામાં હોઈએ ત્યારે મન, સ્વૃળ કેન્દ્રિયો કે બીજી કશાપણી હજરી હોતી નથી, સ્વાપો પણ આવતાં નથી, આપણો ક્ષાં સૂતા છીએ કે ક્ષારે ઊંધી ગયા તેની ખબર પણ હોતી નથી. ફક્ત શૂન્યાવસ્થા કે અભાવાવસ્થા જેવું હોય છે. જ્યારે ખ્યાન કરવા આસન ઉપર બેસીએ ત્યારે અથવા ખ્યાનમાં બેઠા પછી ધીમે ધીમે મનને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરતા હોઈએ ત્યારે પેલી ગાડ નિદ્રા જેવી સ્થિતિને પાદ કરતા જવું. મસ્તક સ્થિર રહે તંત્ર,

નિદ્રા કે જોકું ના આવે અને છતાંથી નિદ્રા જેવી અભાવની સ્થિતિ લાવવાનો, સંપૂર્ણ શૂન્યાવસ્થા, નિદ્રામાં હોય છે તેવું નિર્વિષ્પપણું લાવવાનો પ્રયત્ન કરવાનો. તો સારી એવી એકાગ્રતા પ્રાપ્ત થઈ શકે.

ખાનમાં અવારનવાર બેસવાથી થોડી થોડી એકાગ્રતા આવે છે, મન પ્રસ્તુત રહે છે, જીવનમાં શાંતિ અને સમાધાન જેવું લાગે છે, સુખદુઃખના પ્રસંગોએ મન વિચલિત નથી થતું. અને પૂ. શ્રી ગુરુદેવના આશીર્વાદ્યી કલ્યાણમાર્ગમાં આગળ વધવાની પ્રેરણા મળે છે. અસ્તુ.

(પૂ. શ્રી ગુરુદેવના “મુક્તા” પુસ્તકમાંથી)

યોગાશ્રમ

- મનિષ બી. પટેલ

અત્યારે યોગનો વિષય ખૂબ જ ચર્ચાસ્પદ અને આવકાર્ય બન્યો છે. આપણો દેશ તથા બીજી અન્ય પણ દેશો યોગ તરફ વધ્યા છે. તેથી મને પણ આ વિષય ઉપર લખવાની કિર્દિક ઈચ્છા થઈ. શીર્ષક ઉપરથી ખ્યાલ આવી જ જાય કે યોગ ઉપરનો લેખ છે. હા, લેખ તો યોગ સાથે સંકળાપેલો છે. પણ ‘યોગાશ્રમ’ એટલે શું? યોગાશ્રમ વિશે સમજવા માટે થોડું આપણા પ્રોગ્રામ તથા પ.પુ. ગુરુદેવના વિશે જાવીએ.

આપણા ગુરુજીનું નામ યોગભિકૃત છે તેવું જ્યારે કોઈ સાંભળે છે ત્યારે તે પૂછે છે કે તમારા ગુરુજી યોગ શિખવાડે છે? મારો જ્વાબ હા-માં સાંભળી તેનો વળતો પ્રશ્ન હોય છે કે ક્ષાં અને ક્ષારે? ત્યારે હું આપણા પ્રોગ્રામનું લિસ્ટ તેના હાથમાં આપીને કહું હું કે મારા ગુરુજીની વર્ષમાં આવતી યોગશિબિરોનું આ લિસ્ટ છે.

નવાઈ લાગશે પણ આ હકીકત છે. આપણે જ્યારે સ્વાધ્યાય-સત્સંગ કરતા હોઈએ છીએ ત્યારે આપોઆપ આપણાથી યોગ થતો જ રહે છે.

ઉદાહરણ તરીકે આપણો સંગીતમય ગાયત્રીમંત્ર. ‘ગાયત્રીમંત્ર એક જ છે પણ તેને બોલનારા દરેક અલગ-અલગ સૂરમાં બોલતા હોય છે.’ આપણો સંગીતમય ગાયત્રીમંત્ર જ્યારે બીલવામાં આવે છે ત્યારે આપણું શરીર આપોઆપ અમુક પ્રકારના યોગ કરવા માટે છે. ગુરુજીએ તેમના અનુભવો તથા સતત ચિંતનનો નિયોડ આ મંત્રોમાં વહી લીધો છે. આપણને ભક્તિ સાથે શક્તિ મળે તેવો પ.પુ. ગુરુદેવનો ઉદેશ છે. સંગીતમય ગાયત્રીમંત્ર સાથે પૂ. ગુરુદેવશ્રીએ રચેલા બીજી ધરણ મંત્રો છે જે આ યોગશિબિરોમાં અવારનવાર બોલીએ છીએ. મંત્રોનું ગાન કરવાથી પ્રાણાયામ આપોઆપ થઈ જ જાય છે. આ ભાષામાં દીર્ઘ પ્રથમોદ્યાર મુખ્ય છે. દીર્ઘ પ્રથમોદ્યાર એ સર્વે પ્રાણાયામના નિયોડ સમાન છે. પૂ. ગુરુદેવશ્રીને દીર્ઘ પ્રથમોદ્યાર કરતા સાંભળવા એ એક લ્લાવો છે. શરીરની સુખાકારી અને આધ્યાત્મિક પ્રગતિ માટે પ્રાણાયામ આવશ્યક છે. પણ તે કોઈ ગુરુદેવની રાહબરી નીચે થવા ધરે. ઉપરનું સર્વે કરવા માટે કોઈ આશ્રમ જ આવર્ષયક

નથી. ગૃહસ્થાશ્રમમાં આ બધું શક્ય છે.

ગુરુજી સ્વાધ્યાય પછી બધાને પ્રસાદ (ભોજન) લેવાનો હંમેશા આગ્રહ રાખે છે તેનું કારણ પણ આ જ છે. સ્વાધ્યાય દરમ્યાન બોલાયેલા મંત્રોથી પ્રજ્વલિત થયેલો જઠરાંજિ શાંત કરવા માટે સાત્ત્વિક અને સાહું ભોજન લેવું જ જોઈએ.

આ તો થઈ યોગ માટેની વાત. હવે આશ્રમ વિશે ગુરુજી શું કહે છે તે પણ સમજુંબે.

ગુરુજીનાં પુસ્તકોમાં તથા આપણાં બેનર ઉપર આપણે હંમેશા વાંચીએ છીએ કે ઈંટ-ચૂનાના આશ્રમોનો પુનરૂદ્ધાર કરવાની જરૂરત કરતાં પહેલી અને વધુ જરૂરત છે જીવતા-જીગતા ગૃહસ્થાશ્રમોનો પુનરૂદ્ધાર કરવાની. પ.પુ.ગુરુજીની ઈચ્છા દરેક ઘર આશ્રમ બને તેવી છે. દરેક ઘરમાં આશ્રમ જેવી શિસ્ત, સદ્ગુરુભાવના, એકબીજા પ્રત્યેનો પ્રેમ તથા સુખ-દુઃખમાં સાથે રહેવાની ભાવના હોવી જોઈએ.

પ.પુ.ગુરુજી અવારનવાર ઉદાહરણ આપીને સમજાવતા હોય છે કે આપણે શું કરીએ તો ઘરને આશ્રમ જેવું બનાવી શકાય. તો, એ અર્થમાં તો

આપણે ઘરને આશ્રમ બનાવવાનો છે, પણ સાથે સાથે યોગાશ્રમ પણ બનાવવાનો છે.

સાચી સમજજ્ઞપૂર્વક સાથે મળીને ઘરમાં કરાયેલા સ્વાધ્યાય-સત્તસંગથી આપણું ઘર યોગાશ્રમ બને છે. અને જો દરેક ઘર આ પ્રમાણે યોગાશ્રમમાં ફેરવાઈ. જીથ તો પછી બીજા કોઈ જ આશ્રમની કોઈને પણ જરૂર નહીં પડે.

પ.પુ. ગુરુદેવશ્રીનો ઉદેશ બહુ જ જિયો છે. તે આપણને કેમ કરીને રોગો તથા સમજજ્ઞાનાં દૂષખો સામે લડવું તે શીખવે છે, જો દરેક ઘર યોગાશ્રમ હોય તો. મંત્રોથી યોગ અને ગુરુદેવનાં રહેલાં ભજનોથી સાચી સમજજ્ઞ માપન થાય છે અને તે આપણને આપિ, વાધિ અને ઉપાધિમાંથી મુક્ત કરાવે છે.

આવો, આજે આપણે સર્વે મળીને સંકલ્પ કરીએ કે આપણે આપણા ઘરને યોગાશ્રમ બનાવીશું તથા બીજાને પણ તે કરવા માટે પ્રેરણ આપીશું, મદદ કરીશું અને પ.પુ.ગુરુજીની વિચારખારાનું પાલન કરવાનો ગ્રયતન કરીશું.

: ગૃહસ્થાશ્રમ-પ્રવેશાર્થીને :

વિશ્વ માટું કુટુંબ છે એ સૂત્ર ભારતીય સંસ્કૃતિના પ્રાણ સમાન છે અને એ સૂત્રની ભાવનાને વર્તનમાં મૂકવા માટેનો પ્રારંભ થાય છે ગૃહસ્થાશ્રમ પ્રવેશાર્થી.

સાચી સમજજ્ઞાની વાતો

- પ્રવિષ્ટભાઈ શાહ

પ. શ્રી ગુરુદેવના સત્તસંગમાં સ્વાધ્યાય, મંત્રજ્ઞય, ભજન, પૂન, આરતી વગેરે કાર્યક્રમ થાય, ધ્યાન, યોગ, સાધના, સમાપ્તિની વાતો થાય. પ.શ્રીનાં આશીર્વયનમાં ગુરુજીની જ્ઞાનવાણીનો લાભ મળે. સત્ત-સાહિત્ય પ્રચાર-પત્રિકા, આમંત્રજ્ઞ-પત્રિકા કે સદ્ગુરુભાગ્રમેભીઓના બહારગામથી આવેલા પત્રોનું વાંચન થાય. સત્તસંગ ચાલતો હોય અને જુલાઈ-૨૦૦૭

કોઈકવાર કોઈકનો ટેલિફોન આવે તો પૂ.શ્રી એમાંથી પણ જ્ઞાનવા જેવી વાત સત્તસંગમાં બેઠેલાંઓને કહી સંભળાવે. સ્વાધ્યાય ચાલતો હોય અને વાતમાંથી વાત નીકળે તો ત્યારે પણ ગુરુજી સ્વાધ્યાય અટકાવીને કોઈક સૂચના કે ટકોર કે ઉપયોગી માહિતી આપે અને પાછો સ્વાધ્યાય ચાલુ થાય. પાંચ-પચાસ માઝસો બેઠેલાં હોય કે પાંચસો

માણસોની હાજરી હોય, આ બધી વાતો એટલી આત્મિયતાથી ચાય અને સાંભળનારાં સૌ એટલી તન્મયતાથી સાંભળે કે ઘરીબર તો સીને આનંદ-આનંદ થઈ જાય, આવી હળવાશની પળોમાં થયેલી કેટલીક સાચી સમજણાની અને ઉપયોગી વાતો અહી રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે.

હળવદમાં શ્રી રમેશભાઈ પાકુક ગુરુજીના અનન્ય પ્રેમી, કોઈક વાર એમને કંઈક લાભ થયો હોય તો તેની ખુશી વ્યક્ત કરવા સવારના પલોરમાં ગુરુજીને કીન કરે. ગુરુજી નિત્યકમમાં-ગ્રાતાર્થમાં વસ્ત હોય તો પણ તેમની વાતો શાંતિથી સાંભળે. તેઓશ્રી ગુરુજીને બધુ વિગતવાર જણાવે. ક્યારેક કંઈક દુઃખદ બીના બની હોય તો તેની પણ વાત ગુરુજીને કીન ઉપર કરે. યોડા દિવસ પછી એ દુઃખદ વાતનો ઉકેલ થઈ ગયો હોય તો વળી પાછા સવારમાં જ ગુરુજીને કીન ઉપર જણાવે કે - ગુરુજી! પેણુ જે વિન આવી પડ્યું હતું ને તે આપની કૃપાથી ટળ્યી ગયું છે! પુ.શ્રી સત્સંગમાં આજુભાજુમાં બેઠલાંઓને પૂછે - કે બોલો આમાં ગુરુજીની કેવા સ્થિતિ હતી હશે?!

અમેરિકામાં આપણા ઓમ્ન પરિવારના ગુરુપ્રેમી ભાઈશ્રી સોલંકી રહે છે, તેમનો સ્વભાવ ખૂબ જ સંતપ્તેમી, ગુણગાહી અને ગુરુનિર્ણાવાળો. ગુરુજી અમેરિકાના પ્રવાસમાં હતા ત્યારે પુ.શ્રીની સેવામાં તેઓ સાથે રહેતા. વધીં વર્ષોથી અમેરિકામાં રહે છે એટલે ત્યાંનું અંગ્રેજ સારી રીતે જાણે અને ગુરુજીના પ્રવચન કે વાતાલાપ દરમ્યાન દુભાપિયા તરીકે પણ સેવા આપે. પુ.શ્રી એ તેમના વિપે કહેલી એક-બે વાત લખું છું, સોલંકીભાઈ એક સંતની સંસ્થામાં પ્રમણોપાત જાય એટલે તેમનાથી સારા પરિચિત અને આત્મીય, એ સંત સોલંકીભાઈને ક્યારેક ક્યારેક કહે કે સોલંકીભાઈ તમે સાહુની દીક્ષા લઈને અમારે તાં

આવી જાવ! સોલંકીભાઈ બે હાથ જોડીને સંતને જવાબ આપે કે સ્વામીજી! જેમ છે એમ બરાબર છે. વળી યોડા દિવસ પછી સંતથી કહે કે, તમે અમારે ત્યાં આવી જાવ. અને તેઓ બે હાથ જોડીને જવાબ આપે કે સ્વામીજી! જેમ છે એમ બરાબર છે.

એક દિવસ ફરી જચારે આવી વાત નીકળી ત્યારે સોલંકીભાઈને સંતને બે હાથ જોડીને કહું કે હું આપને ત્યાં આવું ખરો પણ મારી એક શરત છે.

સ્વામીજી કહે - "તમારી જે શરત હશે તે મંજૂર!"

તેઓ કહે - "હું જચારે પણ આવીશ ત્યારે એકલો નહિ આવું, સાથે ૧૦-૧૨ જણાને લઈને આવીશ!"

સંત (હસ્તાં હસ્તાં) કહે કે એ તો બધુ જ સરસા!

સોલંકીભાઈ કહે - "મારી વાત આગળ ચલાવું ... હું આપને ત્યાં મારાં ૧૦-૧૨ માણસોને લઈને આવું ખરો ... પણ ..." એવું કહીને તેઓ સહેજ અટકી ગયા.

સ્વામીજીને પ્રશ્નસૂચક ભાવે તેમની તરફ જોયું.

સોલંકીભાઈને બે હાથ જોડીને કહું - "પણ બાપજી! એવું છે ને ... બાપજી! એવું છે ને કે મને તમારા ત્યાં જો બધુ ટીક ના વાગે તો હું પાછો ચાલ્યો જાઉ ... અને તે વખતે હું એકલો નહિ જાઉ પણ તમારા ૩૦-૩૫ જણાને મારી હારે લેતો જઈશ!"

સંત કહે - "ભાઈ, તમે ખરા જબરા હોનો!"

ગુરુ-સંતો સાથે આટલી આત્મીયતા હોય અને સાંચિક આનંદની આવી પ્રાપ્તિ થતી હોય તો ભૌતિક સુખ-રંગપત્રી તો ગોણ બની જાય! અસ્તુ.

એક વખત "ધર્મમેધ"માં સ્વાધ્યાય ચાલુ હતો. પુ.શ્રી ગુરુદેવ અને આહ-દસ જણાની હાજરી હતી.

શ્રી નવીનભાઈ મહારાજ ખલે જેસ-પંચિયુનાખીને આવ્યા હતા. ગુરુજીને પૂછ્યું,

“નવીનભાઈ ક્યાં જઈ આવ્યા?” ‘એક યજમાનને ત્યાં તેમના બાંપુણું બારમું સરાવવાનું હતું એટલે ગયો હતો. ત્યાંથી બારોબાર આવું શું.’ નવીનભાઈએ હાથ જોડીને કહ્યું.

ગુરુજી થોડીક વાર મૌન રહ્યા.

પછી ધીર ગંભીર સ્વરમાં ગુરુદેવશ્રીએ કહ્યું,

‘આપણા શાસ્ત્રોમાં સોળ સંસ્કારની વાતો આવે છે. બાળક જને, મોટો થાય - ભણે ગણે - નોકરી પણો કરે - સંસાર માટે - કુટુંબ-પરિવાર થાય - ધર્મ-અર્થ-કામ અને મોકાની પ્રાપ્તિમાં જીવન વિતાવે અને છેવટે મૃત્યુ એ છેલ્લો સંસ્કાર - અંતિમ સંસ્કાર! આ સોળ ગ્રાચારના સંસ્કારોમાં દીકરાની વહુનું સીમત અને બાપનું બારમું એ બે પ્રસંગો એટલે માણસના સમગ્ર જીવનની બે વિરલ ઘટનાઓ કહેવાય, સુખ અને દુઃખની ચરમસીમાં

જેવા બે પ્રસંગો કહેવાય. દીકરાની વહુનું સીમત એટલે ખૂબ જ આનંદનો દિવસ. કુટુંબમાં એક નવા જીવનું આગમન થવાનું છે. દીકરાને ત્યાં દીકરો કે દીકરી આવે ત્યારે કોને આનંદ ના થાયે? એવી જ રીતે બાપનું બારમું એટલે કુટુંબમાંથી એક સભ્યની ચિર વિદ્યાય! બાખા જીવન દરમ્યાન માનતરની જે શીણી છતછાયા હતી તે હું થઈ ગઈ, જેમની હાજરીથી ઘર બર્યું બર્યું લાગતું હતું તે - ઘરના એક વડીલ - કુટુંબના એક મોભી - બધાંથેને મૂકીને ચાલ્યા ગયા. કેટલું બધું દુઃખ થાય!

એટલે આમ જોવા જઈએ તો બંસે પ્રસંગોમાં બને છું? એકમાં જીવનું આગમન થાય છે અને એકમાં જીવની વિદ્યાય થાય છે! પણ લડીકતમાં તો જીવ ક્ષયાંથી આવતો પણ નથી અને જીવ ક્યાં જતો પણ નથી ... બધું અહીનું અહીં જઇ!!!” અસ્તુ,

એક અહિંસા-દ્રષ્ટા : વર્ષા (વગર છરીએ સર્જરી)

બેઠીસ વર્ષ પહેલાંની વાત છે, જ્યારે મને પહેલી વાર આંખમાં ઝાંખપ વર્તાઈ; થોડે દૂરની વિક્ષિતાઓ અને વસ્તુઓ પણ ધૂપળી, અસ્પષ્ટ, જીણવા લાગી. મરીન ગ્રાઈફ પર નજીક જ રહેતા આંખના ડોક્ટર સાહેબ અશોક શ્રોફને બતાવ્યું; એમણે મોતિયાનિહનું નિદાન કર્યું અને જોપરેશન કરાવવાની સલાહ આપી. પરંતુ ચરમા પહેલવા માત્રથી જ દૂરનાં દરથો, માણસો, વગેરે સાફ દેખાતી હોવાને કારણે મે શરૂકિયા ન કરવી. એક સાહેબ પાસે ત્યાર પછી અનેક વેળા આંખો તપાસાવેલી. મારું મન વાચી લઈને એમણે દરેક વેળા કહ્યું કે મોતિયામાં કોઈ કુદરતી ઉપયાર, હોમિઓપેથિક કે આયુરોદિક ટીપાં કારગત લાગતાં નથી. સપ્રેમ પરંતુ ભારપૂર્વક એ મને આ બાબત જુલાઈ-૨૦૦૭

ચેતવતા રહેતા. વર્ષી બીતતાં ગયાં; ગોપાણી સાહેબથી ચેશમા મેળવતા રહી, બે દાયકા આમને આમ વિતાવ્યા.

ગત વર્ષ પેટના અલ્સર જેવી ભારે પીડાદાયક માંદગી ચાર-પાંચ મહિના સુધી પર કરી ગઈ. જેસ્ટ્રોક્સીપી કરાવ્યા કિના જ મેં આ તકલીફનું નિદાન ‘હેલીકોલેક્ટર પાઈલોરી’ કરેલું. નિર્દોષ આહાર, વનસ્પતિ ઔષ્ણ, હોમીઓપેથિક ગોળીઓ ઉપરોક્ત પેટ પર તરફો, માટી, પાણી-પોતાં, વગેરે કુદરતી ઉપયારો કરતા રહેતાં, તથા કપોળ સેનેટેરિઅમના નિષ્ણાત એક્ચ્યુપ્રેશરિસ્ટોની ટ્રીટમેન્ટ થકી એમાંથી પણ મુક્તિ મળી. પરંતુ ત્યાર પછી આંખની ઝાંખપ થોડી વધી હોય એવું લાગ્યું. આધ્યાત્મિક વૃત્તિના ચંદ્રારોગ નિષ્ણાત ઢો. કુલિન કોઠારી પાસે આંખ

તપાસાવવાનો આગ્રહ અનેક મિત્રોનો રહ્યો. તેથી તરફ મહિના પહેલાં (એપ્રિલ ૨૦૦૬) એમની કિલનીકમાં પહોંચી ગયો. તપાસમાં મોતિયા-નિદુ તો બને આંખમાં જણાયું છે; ઉપરાંત જામર (ગ્લોકોમા) પણ જણાયું! કોઈરી સાહેબે અમુક ટીપાં વાખી આપ્યાં, જે રોજ નિયમિત નાખવાનાં હતાં; તરફ સપ્તાહ પછી ઓપરેશન માટે આવવાનું નક્કી કરાયું. બોજે દિવસે એક પ્રેમાળ મિત્રે આગ્રહ કર્યો કે એમનાં ભાલેજ પણ ચક્કુરોગ નિષ્ઠાત હતાં તેમને પણ મારે આંખો બતાવવી. એ ડેક્ટર બેન નિષ્ઠિતા અગરવાલા, જેઓ હિન્દુજી હોસ્પિટલમાં સેવા આપે છે, તેમણે પણ બાડી તપાસને અંતે કુલિનભાઈનાં સુચનોને જ ૧૦૦ ટકા અનુમોદન આપ્યું. અને ઓપરેશન કરાવવા સિવાય કોઈ આરો ન હતો એવું ભારપૂર્વક કહું.

કરમાવવામાં આવેલી દવાની નાનકડી શીશી ખરીદી. એ ખોલતાં પહેલાં એના કારટનમાંથી નીકળેલા અતિ-લાંબા માહિતીપત્રક તરફ મારું ધ્યાન ગયું. કાળજીપૂર્વક એ પત્રિકાનો અભ્યાસ કરતાં જણાયું કે આ ટીપાંના ઘણા બધા અખતરાઓ ઉદ્દર, ગીનીપીઝ્સ, સસલાં અને વાનરો પર કરાયા હતા! પ્રાણીઓ પર ફૂરતાભર્યા પ્રયોગો કરીને શોધાપેલી દવા હું કઈ રીતે વાપરી શકું? તેની મુંજુવણ્ણમાં બેન્ન્રાં દિવસ ટીપાં નાખ્યા વિના જ ૩ વિતી ગયા. તે દરમ્યાન એક વેળા ફોન પર એક સ્નેહી જૈન બેન સાથે અન્ય એક સંદર્ભમાં વાતચીત કરતાં મે પેલાં ટીપાંની અને પ્રાણીઓ પર અખતરા કરીને 'વિવિસેક્સન' દારા તેની શોધ થયાની વાત કરી. આ બેને "જેનોલોજી" માં Ph.D. કરેલ છે અને આયુર્વેદમાં પણ સારી જાણકારી પરાવે છે. મેડિકલ રિસર્ચ લેબોરેટરીઝમાં પ્રાણીઓ પર આયરવામાં આવતી હિસાથી એ સુપેરે પરિચિત છે. ડેક્ટરી સંશોધનમાં પ્રવર્તતી વ્યાપક ડિસા પ્રત્યે જૈન

સમાજમાં જે ઉદાસનીતા અને ઉપેક્ષા સેવાય છે, તે અંગે અફસોસ જાહેર કરતાં બેને જે વેપક ટીકા કરી તે આજીવન યાદ રહી જાય એવી હતી. "ન જાણે કેટલાં પ્રાણીઓને આપણે અંધાપો આપતાં હોઈશું, કક્ત એક માનવીને અંધાપાથી બચાવવા કાઢે! ન જાણે કેટલાં જીવોના પ્રાણની આદૃતિ આપણે આપતાં હોઈશું, એક માનવીના 'હાર્ટ-ફેર્લ્યોર'ને અટકાવી તેને 'હાર્ટ-સક્સેસ' આપાવવા કાઢે!"

આ દદ્યા-સ્પર્શ ટકોર મારે માટે પર્યાપ્ત હતી; અવધવમાં રહેવાનું મારે કોઈ કારણ નહોંતું. નિષ્ઠાય લેવાઈ ગયો તે દિનથી : "નથી ટીપાં નાખવાં! નથી સર્જરી કરાવવી!" દાણી મળી ગઈ છે એ સુરત-નિવાસી વર્ધબેન ગાંધીની દૃપાથી! આંત: ચક્કુના મોતિયા-નિદુની વગર છરીએ સર્જરી થઈ ગઈ છે!

Health is the first wealth. Do not lose it. But if you do, regain it the natural & Spiritual way.

— ડૉ. એમ. એમ. ભમગરા
લોશાવલા : જૂન ૨૦૦૬

"ધન્ય-ધન્ય છે ભમગરાજ"

એક અહિંસા દાખાએ લેખ વાંચી મન ડૉ. ભમગરાજ માટે કોઈ વિશેષજ્ઞ ગોતવા લાગ્યું - તેઓશ્રીને કયા વિશેષજ્ઞથી નવાજવા તે બાબત ચિત્ત ચિત્તવાદ લાગ્યું. પણ વ્યર્થ, કોઈ પણ વિશેષજ્ઞ તેમની વિશેષતાને વ્યક્ત કરી શકે તેવું ન લાગ્યું. કક્ત "ધન્ય-ધન્ય છે ભમગરાજ તમને" ... એટલા માનસિક ઉદ્ગારો કરીને મન પ્રસત્તાની અવધિએ-સમાચિયે પહોંચી ગયું.

— યોગનિતુ

વીણોલાં મોતી

સંકલન - શાલ્ગુન પટેલ

ગુરુભક્તિ એ લોલભભક્તિ કે કોભભક્તિ નથી;
એ તો ગ્રેમભભક્તિ છે.

* * *

જાગો હે મહાકાળ, જાગો જીવન કે જવાલ;
ભર્મ કરો પાપી કે પાપ કો,
ધર્તી પુકારે પ્રભુ આપ કો.
જાગો હે શંકર પ્રલયંકર અત્પદંકર જાગો!
કંકર કંકર તુમહે પુકારે શિવશંકર જાગો!
ઓ! દેવો કે દેવ ગંગાધર મહાદેવ જાગો
અબ તો નીદ ત્યાગો

* * *

કથા, સપ્તાહ, સુરષા, ચિત્તન, મનન, ગુડ-

સંતસેવા વગેરેનું ફળ મળ્યું તો જ કહેવાય જો
અતિહર્ઘના પ્રસંગે છડી ન જઈએ અને અતિશોકના
પ્રસંગે ભાંગી ન પડીએ. અતિહર્ઘનેય પચાવી લઈએ
અને અતિશોકનેય જરવી જાણીએ.

* * *

“રે મન મુરખ તુ, હોતા ક્યો અધીર?
પીછે બાલક જન્મ લે, આગે ઉપજત ખીર!”

* * *

“એવો કસુંબો શું કામનો જે ચે અને ઉત્તરે,
ભાંગ, પંતૂરા, ગાંઝિયા ઉત્તર જીત પલ-છિન;
નામ રસાયન નાનકા, ચડી રહે રૈન હિન!

- યોગભિકૃ

વીણોલાં મોતી

(પ.પુ. ગુરુદેવશ્રી શ્રી યોગભિકૃશુળ એ પોતાના પ્રેમીઓને પાઠવેલ પત્રો “મૃતસંજીવની” માંથી સાભાર...)

સંકલન : ડૉ. સાદગુરુ સમર્પણભિકૃ

હરિકૃપા તથ જીનિએ, દે માનવ અવતાર;
ગુરુકૃપા તથ જીનિએ, ધૂડાવે સંસાર (મનસે);

* * *

ગુરુ નિલા તથ જીનિએ, મિટે મોહ તનતાપ;
હર્ષશોક વાપે નહીં, તવ ગુરુ સ્વયં હી આપ.

* * *

રામ ભજનમે આલસી, ભોજનમે હુશિયાર;
તુલસી એસે જીવકો, લાખ બાર વિકાર.

* * *

પૂર્વ જન્મના અને પૂર્વ જીવનનાં સુફુતના
ફળરૂપે સુખની પ્રાપ્તિ થાય છે અને દુષ્ટતના ફળ
દુઃખની પ્રાપ્તિ થાય છે. જેમ સુખ કાયમ નથી
રહેતું તેમ દુઃખ પણ કાયમ રહેતું નથી. દુઃખ સમયે
મનને પૈદ્યપૂર્વક હિતાર-સુરષામાં જોડી રાજવાથી

જુલાઈ-૨૦૦૭

દુઃખના વધુ મોટા ચકરાવામાં પડવાથી બચી જવાય
છે. જ્વાં સ્વૂળ ઉપાયોનો અંત આવી જાય છે ત્યાંથી
પ્રભુ સુરણારૂપી સૂક્ષ્મ ઉપાયોનો ગ્રાંસંભ થાય છે.

* * *

જ્વાં ચમત્કાર જેવું કાઈ નથી ત્યાં ચમત્કાર
અનુભવો એ પણ મોટો ચમત્કાર છે. એ તો સૌ
પ્રેમીઓનું અધિકારીપણું, મહાનપણું અને ઉદારપણું
છે. બદાર હેખાતું મહાનપણું એ તો પોતાની અંદર
રહેલા મહાનપણાનું પ્રતિબિંબ માત્ર છે.

ભગવાનને મહાન તેમના ભક્તો કરે છે,
ગુરુજીને મહાન તેમના શિષ્યો કરે છે અને સંતોને
મહાન તેમના પ્રેમીઓ કરે છે અને તે બધી
અધિકારપણાની સાબિતી છે.

* * *

સગા-સ્નેહીઓ કમા આપે તે તેમની ઉદારતા છે; ગુરુસંતો કમા આપે તે તેમનો સ્વભાવ છે; અને પરમ શુરૂ કમા ન આપે, કર્મફળો બોગવાવે તેમા જ આપણું ભલું છે.

* * *

યુવાન વર્ગ જો યોગ તરફ વળે તો વિશ્વ પર પણો ઉપકાર થાય.

(૧) શશ્ચલી અને દીર્ઘજીવી સુખશાંતિના તફાવતને પારખવાની કુશળતા પ્રાપ્ત થાય અને (૨) સહનશક્તિ કેળવાવીને શક્તિના ઘણા મોટા જથ્થાનો દુર્બ્યથ થતો અટકાવી શકાય તો કલ્યાણની ઘણી નજીક પહોંચી જવાય.

પ્રેરણા આપીને વસ્તુની અસલ કિમત સમજીની દેવાની કર્ષ વિશેપણોની છે. સૌ કિમતી વસ્તુ જ પસંદ કરે છે; એહી કિમતની વસ્તુ પસંદ થઈ જાય તે તો કિમત વિષેની અજ્ઞાનતાના કારણે.

* * *

જીવનના દરેક દાખિકોણમાં કસે કસે સદ્ગુરીની લાવતા રહેવાથી સાવ સહેજમાં જ કલ્યાણની ટોચ ઉપર જઈ પહોંચાય છે.

* * *

જે સ્વયં રેતી જીવ છે તે મહાવીર છે; જે અન્યોના ચેતવણાથી ચેતે છે તે વીર છે; જે ડોકરો ખાઈ ખાઈને ચેતે છે તે ખીર છે; જે કોઈપણ રીતે ચેતતો નથી તે બધીર (બહેરો) છે. અને જે, ચેતાવનારનું ગણું પકડે છે તે ભાગ્યહીન છે. આ બધી વાતો-રહસ્યો જેને સમજાય છે તે ભાગ્યશીલ છે. આ બધું સાંભળ્યું કરનાર વિવેકહીન છે.

* * *

અત્યારનો માનવી તો અનેક ચા ખાઈખાઈને ચેતે તોય ઘણું. તોય તેની બલિહારી. પરહૃદયબંજકોએ હતોત્સાહ થયા વિના કાર્ય કર્યે રાખવું. મનુષ્ય ચલ હૃદાર રૂપા.

* * *

ઉમરથી મોટા તે મોટા નહીં પણ સાચી સમજાણ્યી જે મોટા તે મોટા અને સાચી સમજાણ એટલે ઉદારતા-વિશ્વાણતા-વિનમ્રતા તથા બીજાના સુખ માટે પોતાના સુખોને જતાં કરવાની તત્પરતા. સાચી સમજાણ એટલે “તારું ધાર્યું” થયા દેવા માટે “મારું ધાર્યું” મૂડી શકવાના તૈયારી.

સદ્ગુરુ દર્શન !.....?

- યોગબિલુ

સાધનાકાળ દરમ્યાન પ્રામાણિક સાધકોને ધ્યાનમાં તથા તંત્રાધ્યાનમાં અનેત પ્રેરક દર્શય-પ્રસંગો દેખાતા હોય છે. તેનાથી તેને સાધનામાં ઉત્સાહ અને પ્રેરણ ભળતાં રહે છે. સાધકોની ઉત્સાહવૃદ્ધિ અર્થે તંત્રાધ્યાનની એક પ્રેરક અનુભવ નીચે રજૂ કર્યો છે.

શ્રી ગાયત્રી અનુષ્ઠાનના ચૌદમા હિવસે નીચે પ્રમાણેનું પ્રેરક, અલોકિક અને હિવ્ય દર્શય દેખાયું -

આપેડ વધની એક બીમાર દિગંબર મૂર્તિ ધારણની ગમાણમાં ઊભેલી હતી. એક ખાઈ તેમની જુલાઈ-૨૦૦૭

પણે પોતાની તબિયત ખતાવવા આવ્યા તો તેમની નાડ જોઈને તેઓ ગંધી ગાળ બોલ્યા કે જેનો અથ થતો હતો કે નારી બરાબર નથી. બીજી વધોવૃદ્ધ દિગંબર મૂર્તિ દેખાયી. તેઓ પણ વધુ ગંધી ગાળ બોલ્યા. તેઓ બને આપસમાં નેટી પડ્યા. લાંબી હું આગળ ચાલ્યો જતો હતો. મેં કક્ત એક કોપાન પહેરી હતી અને પગ સુધીનું માદરમાટનું ઝાપડું ઓફનું હતું. મારા શરીરને હું અધોર જગતમાં ચાલ્યું જતું જોઈ રહ્યો હતો. પછી મારા શરીરને

થાકીને એક જગ્યાએ પડેલું જોયું. બે-ત્રણ વ્યક્તિઓ ત્યાંથી પસાર થઈ. તેમણે મને ઓળખ્યો. મેં તેમને કહું કે મને....ની વાટ બતાડો. એક જગ્યા આગળ આગળ ચાલવા માંડ્યો. અને હું તેમની પાછળ પાછળ ચાલ્યો જતો હતો. ગુંડા જેવી અંધારી બે ઓરડીઓ દેખાશી. બંનેની જાણીઓ બંધ હતી. હું ત્યાં ઉલ્લો રહી ગયો અને રોતી-રોતો આ પ્રમાણે બોલવા લાગ્યો કે, “મારા નાથ આજ મને દર્શન આપો તમે”; રોતો જાઉં અને ખૂબ જ ઊંચા સ્વરથી ઉપર પ્રમાણે બોલતો જાઉં. થોડીવારમાં તે અંધારી ઓરડીમાં પ્રકાશ થયો, બને ઓરડીઓ બરાબર દેખાશી.

અંદર કોઈ હતું નહીં, ઓરડીઓ ખાલી હતી. મારું રોવાનું અને બોલવાનું ચાલુ જ હતું. એટલામાં એક દિગંબર મૂર્તિ પાછળના ભાગમાંથી દોડતી આવતી જણાંડી. ત્યાં સુધીમાં હું લગભગ જાગૃત થઈ ગયો હતો. તે વખતે મનમાં-મનમાં ખૂબ જ લય લાગવા માંડ્યો હતો કે હમણાં સ્વપ્ન પૂરું થઈ જશે અને મારા ગુરુજી ડોષ છે તે બરોબર જોઈ નહિં શકાય. સ્વપ્ન પૂરું થઈ ન જાય તેનો પણ ખૂબ જ પ્રયત્ન ચાલુ હતો. ખૂબ જ જોરજોરથી રહતો જાઉં અને બોલતો જાઉં.... “મારા નાથ આજ મને દર્શન આપો તમે.” એટલામાં તે દિગંબર મૂર્તિ પાછળના ભાગમાંથી ઓરડીમાં પ્રવેશી. જેમ જેમ ઓરડીમાં તે

નજીક આવતી ગઈ તેમ તેમ આકૃતિ સ્પષ્ટ દેખાતી ગઈ. મનમાં ખૂબ જ ડર છે કે રહેને આકૃતિ પરી દેખાયા સિવાય સ્વપ્ન પૂરું થઈ જશે તો? મૂર્તિ (વ્યક્તિ) નજીક આવતી ગઈ અને વધુ ને વધુ સ્પષ્ટ દેખાતી ગઈ. તેઓ ઠેઠ આગળની જાણી પાસે આવીને ઉભા રહ્યા. શરીર સંપૂર્ણ નન્ન છે; રંગ ખૂબ જ કાળો અને થોડો ચમકતો છે, માથે જરાની અંબોડી વાળી છે, કાપા શરીરમાં દાંત ખૂબ સફેદ દેખાય છે, હજુ મુછનો ઢોરો હૂટચો નથી. મેં તે શરીરને પરાઈને નીરાખ્યું. પછી તરત જ સ્વપ્ન પૂરું થઈ ગયું. બંધ આંખે જ એ બધું યાદ કરવા લાગ્યો - જમણા પણે સૂતો હતો, લાખો લાય હૂંઠી ઉપર હતો. માનસિક રીતે આ રટણ ચાલુ જ હતું “મારા નાથ આજ મને દર્શન આપો તમે.” આજ સ્થિતિમાં સૂતાં સૂતાં એ જ રટણ ચાલુ રાખ્યું અને સ્વમને ખૂબ યાદ કરી લીધું. ઉડીને લખી લેવાનું મન થતું પણ ખાટલામાંથી ઉઠવાનું મન થતું ન હતું. આખર કરેળિયા કરીને ઉઠ્યો અને થરિયાળમાં જોયું તો બરાબર સાડાનાણ વાગ્યા હતા. નોટબૂક અને બોલપેન લઈને બધું લખી નાખ્યું.

તેઓનું મોહું લંબચોરસ હતું, મોઢા ઉપર કોઈ પ્રકારનો ભાવ હતો નહિં. તેઓ મારા સામે મીટ મારીને જોઈ રહ્યા હતા અને હું તેમના સામે મીટ મારીને જોઈ રહ્યો હતો.

ઓમ્ પરિવારના ઉત્સવ

ગુરુપૂર્ણિમા

ઇચ્છાબેનની વાડી,
પુષ્પકુંજ પાસે, કાંકરિયા,
મણીનગર, અમદાવાદ-૮.

૨૮-૭-૨૦૦૭

રવિવાર

સવારે ૮ થી ૨

ઓમ્ પરિવાર ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત પ્રકાશનો :

અ. પલિયનગર મોસાપટી, નારસાપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. (INDIA) ફોન: ૨૭૬૯૯૯૮૫

ગુજરાતી

		રૂ. પૈસા
૧.	ચુણાહિમા (યોગરાહસ્યોદ્યો ભરપૂર) (બીજું આવૃત્તિ) ...	૫૫.૦૦
૨.	મુક્તા (પાતંજલ યોગદર્શન - સમાર્પિણ) (બીજું આવૃત્તિ) ...	૩૮.૦૦
૩.	શાંતા (પાતંજલ યોગદર્શન - સાધનપાદ) ...	૬૦.૦૦
૪.	માગ ચુણુદે (કથણ અને સાધનાની અનુભૂતિ) (બીજું આવૃત્તિ) ...	૧૬.૦૦
૫.	ઈશ્વરની જોગન (ઈશ્વર કોણ કણી શકાય?) (ઓમ્ વિષેની સંપર્ક માહિતી) (બીજું આવૃત્તિ) ...	૬.૦૦
૬.	મનવિજ્ઞાન અને ધ્યાન ...	૨૦.૦૦
૭.	સત્સંગ-પરાગ ...	૨.૦૦
૮.	નિર્જર ઝર્ઝ કો જેખાણી (વિષાભાસાત્મિના અતિ ચુણા કારણોની મૌખિક રજૂઆત) (બીજું આવૃત્તિ) ...	૧૫.૦૦
૯.	કિસાને લાગુ ધ્યાન ? ...	૫.૦૦
૧૦.	સ્વાધ્યાય (બીજું આવૃત્તિ)	૧૦.૦૦
૧૧.	મારે સમાજને બેઠે કરવો છે. (બીજું આવૃત્તિ) ...	૬.૦૦
૧૨.	પ્રેરણાંત્રિ (બીજું આવૃત્તિ) ...	૨૦.૦૦
૧૩.	પ્રેરણાંત્રીયુદ્ધ (શ્રી ચુણુપ્રેમભિલુલના પ્રેરણાંત્રીયા પત્રો).	૬.૦૦
૧૪.	કદું અમૃત (બીજું આવૃત્તિ) ...	૪૦.૦૦
૧૫.	મુખ્યાંકણવની	૩૮.૦૦
૧૬.	વિજ્ઞાના ગ્રંથાદે ...	૬૦.૦૦
૧૭.	બાળાન્નિક ગરબા (કાન્દિકારી તાજપત્રી) ...	૧૫.૦૦
૧૮.	ઓમનારાયણના વિજો (નોટ) ...	૫.૦૦
૧૯.	ઓમનારાયણના વિજો (નાના) ...	૩.૦૦
૨૦.	૫. યોગનિષ્ઠુણ + મનુષ્યપદનો કોટો	૫.૦૦
૨૧.	મનુષ્યપદનો કોટો ...	૩.૦૦

રૂતમ્ભરા (ત્રિમાસીક) લવાજમ : વાર્ષિક રૂ. ૩૦.૦૦, આશ્વર્ય રૂ. ૫૦૦.૦૦

હિન્ડી

૧.	નિર્જર ઝર્ઝ કો જેખાણી (વિષાભાસાત્મિના અતિ ચુણા કારણોની મૌખિક રજૂઆત) ...	૧૦.૦૦
૨.	ઈશ્વરની પહ્યાન (ઓમ્ વિષેની વિસ્તૃત માહિતી- પાતંજલ યોગદર્શન-સમાર્પિણાના ચૂત રૂ. ૨૪ થી ૨૮)	૧૧.૦૦
૩.	કાત-ચિંતન (૫. યોગનિષ્ઠુણ અને મો. પે. ૫. ક્રાસનો પરિયા) ...	૧૯.૦૦
૪.	મુક્તા (પાતંજલ યોગદર્શન - સમાર્પિણ) ...	૫૫.૦૦

English

૧.	Maitri (The Yoga-secret of Universal Peace) ...	2.50
૨.	Streaming from The Invisible (The subtlest causes of world unrest)	7.00
૩.	Easiest is realization (Articles) ...	5.00
૪.	Why Meditation ? ...	3.00
૫.	Yogabhikshu - An Introduction ...	5.00
૬.	I wish to Awaken The Society ...	10.00

ઓડિયો ટેસેટ - સીરી

૧.	સંગીતમય ગાયત્રી મંત્ર ...	૩૪.૦૦	૨.	બજાનો (સાદુ સંગીત)	૩૪.૦૦
૨.	૫. યોગનિષ્ઠુણના પ્રવયનો ...	૩૪.૦૦	૩.	બીજું ચાલીસા ...	૪૦.૦૦
૩.	અલ્લિકિડ કાન્દિકારી ગરબા ...	૩૪.૦૦	૪.	ચુણ બાધની તથા બજાનો ...	૩૪.૦૦
૪.	સ્વાધ્યાય (ઓમ્ પરિવાર)	૩૪.૦૦	૫.	ચુણ બાધની તથા બજાનો (સિલ્ફ)	૩૦.૦૦

ओम् आधार का बोधक (नाम) प्रणव/ओम् है।



(समाधिष्ठान के इश्वर का भावावाद)

- (२४) कलेश, कर्म, कर्मफल और वासना जिसमें नहीं है ऐसा पुरुषविशेष/चेतनविशेष ओम् आधार है।
- (२५) ओम् आधार संपूर्ण सर्वज्ञ है।
- (२६) ओम् आधार के गुरुओं के भी गुरु है और कल की मर्यादा से (जन्म-मृत्यु से) पर है।
- (२७) ओम् आधार का नाम प्रणव/ओम् है।
- (२८) अर्थ के चिन्तन सहित ओम् का जप करना।
- (२९) चिन्तन सहित जप करने से अन्तरायों का अभाव और आत्मसाक्षात्कार होता है।

प्राणिस्थान : ओम् परिवार, १३४, एक्सेसनगर, नालंदा, झज्जराद-३८० ०१३।

● द्रष्टव्यापक उद्देशो :-

- (१) सर्वव्यापक परम सूक्ष्म येतन तात्पुर के जेनुं नाम प्रणव (ओम् -ॐ) छे तेबी भवीति बहुजनसमाजने कराववा प्रयत्न करवो। (२) 'योग' नो प्रयार, प्रसार अने संशोधन करवा प्रयत्न करवो। (३) समाजनुं बैतिक धोरण ऊँचुं लाववा माटे आध्यात्मिक ज्ञाननो साहित्य द्वारा प्रयार अने प्रसार करवानो प्रयत्न करवो। (४) आ उपरांत 'बहुजनहिताय-बहुजनसुखाय'ने लगतां कार्यों जेवां के केळवणी, तबीजी सारवार वगेरे करवा माटे प्रयत्न करवो।

PRINTED BOOK

Registrar of News Papers of India under Regd.No.48770/90
L-5/131/QTY/34/00-91

આધારસ્થાપક તથા આખ્યાતિમિક વડા

પ. પુ. ગુરુદેવ શ્રી યોગભિક્ષુજી

PRINTED & PUBLISHED BY :-

Dr. S. S. Bhikshu for

AUMGURU PREMSAMARPANDHYANBHIKSHU PARIVAR TRUST

3B, Palladihagar Society, Naarangpura, Ahmedabad - 380 013.

Printed at : Shree Graphies, Navrangpura, Ahmedabad.

Hon. Editor : Nareshadh Vyas

(Reg. No. E/4416 Date 11-5-81)

I.T. Exe. U/S 80 G (5) No. H.Q. III/33 (821) 2000-01 Up to MARCH-2005.

To,

LM-863	NV	H
NAVJIVAN	CHERITABLE	TRUST
AMDAVAD		

380014

લાવાજમ દર : -

વાર્ષિક રાખ્ય (ભારતમાં) ...રૂ. 30-00
આજુવન સભ્ય(ભારતમાં) ...રૂ. 400-00
વાર્ષિક સભ્ય (પરદેશમાં) ...૧૫ શ
આજુવન સભ્ય(પરદેશમાં) ...૧૫૧ શ

**લાવાજમ મોકલવાનું તથા
"રાતમ્ભરા"ને લગતો પત્રવ્યવહાર
કરવાનું સ્થળ :-**

(૧) ડૉ. સોમાભાઈ ચે. પટેલ

૩/૦, પલિયેન્ઝનગર
સેન્ટ એવિયર્સ હાઇસ્કૂલ રોડ,
નારણપુરા, અમદાવાદ-૩૮૦ ૦૯૩.

(૨) નૈષધભાઈ સી. વ્યાસ

"સ્વાશ્રય",
૩, ગંગાધર સોસાયટી,
રામનગર પાછળ, મણીનગર,
અમદાવાદ-૩૮૦ ૦૦૮.

સૂચના :-

(૧) લાવાજમ ચેક ભારા અથવા મનીઓર્ડર
ભારા "ઓ. પ્રે. પ. ટ્રસ્ટ"ના નામે
મોકલવું. સાથે આપનું પૂરું નામ,
સરનામું શુદ્ધ અકારોમાં લખી
મોકલવું.

(૨) જે સભ્યનાં રહેણાણનાં સ્થળ
બદલાયાં હોય તેમણે તેમના નવા
રહેણાણનું પૂરું સરનામું લખી મોકલવું
જેથી વ્યવરસ્થાપકોને અંક મોકલવામાં
સરળતા રહે.

પ.પુ. ગુરુદેવ શ્રી યોગભિક્ષુજી
સાથેના સંસ્મરણો તથા પ્રેરક
પ્રસંગો આવકાર્ય છે.